

જિલ્લા શિક્ષણ બિકારી કેર્ચે,  
ઓ-૩, જિલ્લા સેવાસટન-૨,  
અઠવાલાઈન્સ, સુરત  
તા. ૨૫/૦૮/૨૦૨૨

પ્રતિ,

આર્થિકારી,

સુરત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તરફ,

વિષય :- શાળાઓમાં કાનૂની જાગૃતતા / સાક્ષરતા અન્વયે શિબિરનું આયોજન કરવા


સંદર્ભ :- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અઠવાલાઈન્સ, સુરતના પત્ર ક્રમાંક/૨૫/૧૦૩૪/૨૦૨૨

તા. ૨૬/૦૮/૨૦૨૨

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, કાયદાકીય જાગૃતિ લાવવા તથા યુવાનોને કાયદા વિષે શિક્ષિત કરવા કાનૂની સાક્ષરતા મંડળો દ્વારા શાળા અને કોલેજોમાં કાનૂની સાક્ષરતા પ્રોત્સાહિત કરવા તથા યુવાનોની માનવ અધિકારો તથા નબળી વરસ્તી માટે ન્યાય મેળવવાની પહોંચની હિમાયત કરવાની ક્ષમતા વિકસાવવા નામં ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ તરફથી મોકલવામાં આવેલ એકશન પ્લાન અન્વયે દરેક માસમાં શાળાઓમાં કાયદા વિષેના જ્ઞાન માટે કાનૂની શિબિરનું આયોજન કરવા જણાવવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓના અભ્યાસ ન બગડે તથા શાળાને કોઈ અદ્યારણ ઉભી ન થાય તે રીતે શાળાઓમાં આ પ્રકારની શિબિરનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા કરવામાં આવે ત્યારે સંપૂર્ણ સાથ સહકાર આપવા આથી જણાવવામાં આવે છે.

બિડાણ :- સંદર્ભ દર્શિત પત્રની નકલ

  
જિલ્લા શિક્ષણ બિકારી  
સુરત. જિલ્લો-સુરત

નકલ રવાના સવિનય જાણ સારું

- સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રમ નં-૭૨૩, સાતમો માળ, જિલ્લા ન્યાયાલય, અઠવાલાઈન્સ, સુરત
- મેસચિવશ્રી ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

નકલ રવાના જાણ તથા અમલ થવા સારું

- શિ.નિ.તથા મ.શિ.નિ - આ કચેરી

## જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત.

વિમલ કે. વ્યાસ

ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ



કુમ નં. ૭૨૩, સાતમો માળ,  
જીલ્લા ન્યાયાલય, આઠવાલાઈન્સ,  
સુરત - ૩૯૫ ૦૦૭.

એચ.ડી.જોટાણીયા

પૂર્ણકાળીન સચિવ,  
(અધિક સીની. સિવિલ જ્જ અને એડી.ચીફ જ્યુડી.મેજી.)

ફોન અને ફેક્સ નં. :- ૦૨૬૧-૨૬૫૧૮૦૪  
ઈ-મેઇલ :- [dlsa.sur-gj@nic.in](mailto:dlsa.sur-gj@nic.in)

જાવક નં. ૧૯૩૪ સાને ૨૦૨૨.

તારીખ : - ૨૯.૦૮.૨૦૨૨.

પ્રતિશ્રી,

જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી,  
જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી,  
સુરત....

વિષય : - સ્ટેટ એક્શન પ્લાન મુજબ વર્ષ દરમ્યાન શાળાઓમાં શિબિરોનું  
આયોજન કરવા બાબત....

સવિનય આજ્ઞાનુસાર જણાવવાનું કે, ન્યાય એ દરેક સુસંસ્કૃત રાજ્ય માટેની આધારશિલા તથા મૂળભૂત ઘોય છે. કાયદાનો મુખ્ય હેતુ ન્યાય છે જે કોઈપણ સમાજની સુવ્યવસ્થિત પ્રગતિનું પ્રતિબિંબ છે. પાચાની કાનૂની તથા નાગરિક સ્વતંત્રતાનું, માનવ અધિકારોનું, બંધારણીય નિર્ણયો કે જે લોકોની ગરિમા તથા સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, તેનું અજ્ઞાન પોતે જ સમાજમાં રહેતી સમસ્યાઓ સૂચવતું હોય છે. જેમ કે બાળમજૂરી, માનવ વ્યાપાર વિગેરે સ્વરૂપમાં કે જે તમામની સલામતી માટે ઘમકીરુપ છે. લોકોના પક્ષે રહેલી જાગૃતિના અભાવે કે જેઓના માટે જ કાયદાઓ ઘડવામાં આવે છે તથા કાયદા હેઠળના હક્કો તથા વિશેષાધિકારોની અજ્ઞાનતાના કારણે, તેઓને પોતાની સાથે કશુ ખોટુથયાનો કે કશુ નુકશાન થયાનો ખ્યાલ આવતો નથી કે જેનું કાયદાકીય પ્રક્રિયા દ્વારા નિરાકરણ થઈ શકતું હોય છે. આથી, લોકોમાં કાયદાકીય જાગૃતિ લાવવી સંપૂર્ણપણે જરૂરી છે. લોકોને દેશનાં કાયદાઓની જાગ્રા હોવી જોઈએ. એ પણ વધારે મહત્વનું છે કે કાયદા વિષે ચુવાનોને શિક્ષિત કરવામાં આવે કે જેથી તેઓનો કાયદાને વળગી રહેનારા નાગરિકો તરીકે ઉછેર થાય. આ સ્થિતિમાં, શાળાઓ તથા કોલેજોમાં કાનૂની સાક્ષરતા મંડળો પાસેથી

૨૨/૮

૨૧/૮

કુક્ત કાનૂની સાક્ષરતાને પ્રોત્સાહિત કરવા માટેની અપેક્ષા રાખવામાં જ નથી આવતી પરંતુ તે ચુવાનોની માનવ અધિકારો તથા નબળી વસ્તી માટે ન્યાય મેળવવાની પહોંચની હિમાયત કરવાની ક્ષમતા પણ મજબૂત બનાવશે.

ઉપરોક્ત ઘેયને પાર પાડવા માટે અતેની સંરથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ તરફથી મોકલાવવામાં આવેલ એક્ઝશન પ્લાન મુજબ દરેક માસમાં શાળાઓમાં કાચદા વિષેના જ્ઞાન માટે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરે છે. જેના ભાગરૂપે આવી શિબિરોનું આયોજન કરવા માટે નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, નામદાર સર્વોચ્ચ અદાલત, ન્યુ ઇલ્હી તરફથી જણાવવામાં આવેલ છે.

જેથી ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં રાખી આપશ્રીના તાબા તળે આવતી તમામ સ્કુલોમાં અતેની ઓથોરીટી ધ્યારા કાનૂની શિક્ષણ શિબિરો કરવાનું સમગ્ર વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવે ત્યારે તેવી શાળાઓ ધ્યારા આવી શિક્ષણ શિબિરો કરવા માટે ચોગ્ય સમય અને તારીખ ફાળવવામાં આવે તેવો આદેશ કરવા વિનંતી છે કે જેથી કરીને અતેની કચેરી ધ્યારા આવી શિબિરોનું આયોજન કરવામાં કોઈ અડચણ ઉભી ન થાય.

વધુમાં અતેની કચેરી ધ્યારા આવી કાનૂની શિક્ષણ શિબિરો કરતી વખતે શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ/વિધાર્થીનીઓનું શિક્ષણ કાર્ય ન બગડે અને શાળાને કોઈ અડચણ ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવશે જેણી ખાતરી આપવામાં આવે છે.

આ અંગેનો તમામ શાળાઓને આદેશ કરતો પરીપત્ર/કચેરી હુકમ કરવામાં આવે તેની એક નકલ અતે મોકલાવવા વિનંતી કે જેથી કરીને આવી શિબિરોનું આયોજન કરતી વખતે સદરહું પરીપત્ર/કચેરી હુકમની નકલ જે તે શાળાને મોકલી શકાય.

આભાર સહ,

*અચ.વી.જોટાણીયા*  
(અચ.વી.જોટાણીયા)  
સચિવ,  
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,  
રાજકોટ.